

ઘરીરિક ખોડાંપત્ર ધરાવતા ઉમેદવારો માટે  
ચીંદી ભરતીમાં રાખવામાં આવતી અનામત  
જગ્યાઓ તેમજ ઉપલી વયમર્યાદામાં આપવામાં  
આવતી છૂટછાટ માટે આપવાનું ચાવતા  
વિકલાંગતા(disability) અંગેના પ્રમાણપત્રનો  
નામુનો નિયત કરવા જાબત.

ગુજરાત સરકાર,  
સામાન્ય વહીવટ વિભાગ,  
પરિપત્ર ક્રમાંક:-પરચ/૧૦૨૦૦૮/૪૫૬૪૦/ગ.૨,  
સરચિન્હાલય, ગાંધીનગર.  
તારીખ:-૨/૧૨/૨૦૦૮.

#### પરિચાન:-

કેન્દ્ર સરકારના વિકલાંગ (સમાન તક, અધિકારોનું રક્ષણ અને પુરુષ લ્યાગીદારી) ધારા-૧૯૮૫ ની  
જોગવાઈ છ્યાને લઈને સામાન્ય વહીવટ વિભાગના તા.૧૬/૨/૨૦૦૦ ના છાડેરનામાંથી વિકલાંગ વ્યક્તિઓ  
માટે નોકરીમાં ઉ(ત્રણ) ટા. જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે. તદ્વિપરાંત  
સામાન્ય વહીવટ વિભાગના તા.૫/૧/૬૫ ના દરાવ અને વાયતોવાખાના મુખ્યરાંધોનો જોગવાઈઓ મુજબ  
વિકલાંગ વ્યક્તિઓને સીધી ભરતીથી નિમણૂંક માટે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલ છે. આ  
જોગવાઈઓ મુજબ સરકારી સેવાઓ નાને જગ્યાઓના ભરતી નિયમો મુજબ નિમણૂંક માટે પાત્રતા પરાવતા  
ઉમેદવારો તરફથી વિકલાંગતા(disability) રંગે રજુ કરવામાં આવતા તથીથી પ્રમાણપત્રની  
અકસ્માતીમાં ગુજરાત શાડેર સેવા આપોગ તેમજ અન્ય ભરતી એજન્સીઓને સરળતા રહે તેમજ એકસૂત્રતા  
જગ્યાપ તે હેઠુથી વિકલાંગતા અંગેના પ્રમાણપત્રનો નામુનો નિયત કરવાની જાબત સરકાર શ્રીની વિશારદ્ધા  
હેઠળ કરી. તદ્વાનુસાર ગરતુત આભારે ભારત સરકાર ધારા નિયત કરવામાં આવેલ વિકલાંગતા અંગેના  
પ્રમાણપત્રની વિગતો ધ્યાનો લઈને આ સાથે સામેદ પરિશિષ્ટ-અ' મુજબનો વિકલાંગતા અંગેના  
પ્રમાણપત્રનો નામુનો નિયત કરવામાં આવે છે.

૨. ઉપરોક્ત હેઠું માટે હવેથી વિકલાંગ વ્યક્તિ માટે રાજ્યની વિદ્યા સરકારી હોસ્પિટલોના  
અધિકૃતશ્રીઓ / સિવિલ સર્જનોએ આ સાથે સામેદ કરેલ નામુના મુજબ વિકલાંગતા અંગેના પ્રમાણપત્રો  
આપવાના રહેશે, ગુજરાત શાડેર સેવા આપોગ તેમજ અન્ય ભરતી એજન્સીઓ ધારા સીધી ભરતીથી  
નિમણૂંક માટે ઉમેદવારો પાસેથી અરજીપત્રકો મંગાદવા માટે આપવામાં આવતી શાહેરાતોના સંદર્ભમાં  
વિકલાંગ ઉમેદવારો તરફથી કરવામાં આવતી સરજીઓ સાથે ઉમેદવારોએ આ સાથે જામેલ પરિશિષ્ટ-અ'  
મુજબનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર (Disability Certificate) રજુ કરવાનું રહેશે.

૩. આ કુચનારો રાજ્યની સર્વ જિલ્લા સરકારી હોસ્પિટલોના અધિકારીશ્રીઓ / સિવિલ સર્જનાં તેમજ રાજ્યની તમામ શરીરી એજન્સીઓ તેમજ રાજ્યના તમામ જાહેર ઉપક્રમો / નિગમોની ભરતી એજન્સીઓના ઘાને લાવવા તેમજ તેના અદલ માટે જરૂરી સૂચનાઓ આપવા સચિવાલયના સંબંધીની વિભાગોને આથી આગછુર્ટક જ્ઞાવવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના ફુલમથી ચારે તેમના નામે,

(આઈ.એન.સોલંકી),  
નાયબ સચિવ,  
સામાન્ય વહીવટ વિભાગ,  
ગુજરાત સરકાર.

નિયાચા:- ૫રિશિઅઃ-'અ'

પ્રતિ,

રાજ્યપાલશ્રીના સચિવશ્રી, ગાંધીનગર.

મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી, ગાંધીનગર.

વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી.

તમામ મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રી.

× સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, અમદાવાદ.

× સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.

× સચિવશ્રી, ગુજરાત તાદેદારી આયોગ, ગાંધીનગર.

× રાજ્યસ્ટોરશ્રી, ગુજરાત ઇન્ડિકોર્ટ, અમદાવાદ.

× સચિવશ્રી, ગુજરાત મુદ્દી સેવા ટ્રીયુનાન્ડ, ગાંધીનગર.

× સચિવશ્રી, ગુજરાત ગૌલ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર.

× સચિવશ્રી, ગુજરાત પચારત સેવા પસંદગી મંડળ, અમદાવાદ.

× સચિવશ્રી, ગુજરાત રાજ્ય માહિતી આયોગ, ગાંધીનગર.

સચિવાલયના સર્વ રિભાગો (પાંચ કુલો).

સર્વ જિલ્લા સરકારી હોસ્પિટલોના અધિકારીશ્રી, સિવિલ સર્જનશ્રી,

સામાન્ય વહીવટ વિભાગની તમામ શાખાઓ/અધિકારીશ્રીઓ,

ઝીલેટ ફાઇલ-ગ.ર. ૧૯૮૩, સામાન્ય વહીવટ રિભાગ.

× પત્ર ધ્વારા.

અમ. ૪. પુ. નિઃ ૩૧.૨.૧૨.૨૦૦૮ નિઃ પરિયા કાન્પિંગ, મુદ્દુ - ૧૦૨૦૮. રસેફો. ૧.૨ સાથે (બાંધ)

NAME & ADDRESS OF THE INSTITUTE / HOSPITAL

Certificate No. \_\_\_\_\_ Date : \_\_\_\_\_

DISABILITY CERTIFICATE

This is to certify that Shri / Smt. / Kum. \_\_\_\_\_ Son/wife/daughter of Shri \_\_\_\_\_  
Age : \_\_\_\_\_ Sex \_\_\_\_\_ identification mark (s) is suffering from  
permanent disability of following category :-

A. Locomotor or cerebral palsy :

- (i) BL - Both legs affected but not arms
  - (ii) BA - Both arms affected
  - (iii) BLA - Both legs and both arms affected
  - (iv) OL - One leg affected (right or left)
  - (v) OA - One arm affected
  - (vi) BH - Stiff back and hips (cannot sit or stoop)
  - (vii) MW - Muscular weakness and limited physical endurance.
- (a) Impaired reach
  - (b) Weakness of grip
  - (c) Ataxic
  - (d) Impaired reach
  - (e) Weakness of grip
  - (f) Ataxic

Fix here recent  
attested photograph  
showing the disability  
fully attested by the  
Superintendent/Civil  
Surgeon, Govt. Hospital

B. Blindness or Low Vision

- (i) B - Blind
- (ii) PB - Partially Blind

C. Hearing Impairment.

- (i) D - Deaf
- (ii) PD - Partially Deaf

(DELETE THE CATEGORY WHICHEVER IS NOT APPLICABLE)

2. This condition is progressive / non-progressive / likely to improve / not likely to improve.  
Reassessment of this case is not recommended / is recommended after a period of \_\_\_\_\_ years \_\_\_\_\_  
months. (Strik out which is not applicable).

3. Percentage of disability in his/her case is \_\_\_\_\_ Percent.

4. Shri / Smt. / Kum. \_\_\_\_\_ meets the following physical requirements for discharge  
of his / her duties :-

(i)	F-can perform work by manipulating with fingers	Yes/No
(ii)	PP-can perform work by pulling and pushing	Yes/No
(iii)	L-can perform work by lifting	Yes/No
(iv)	KC-can perform work by kneeling and cratching	Yes/No
(v)	B-can perform work by bending	Yes/No
(vi)	S-can perform work by sitting (on bench or chair)	Yes/No
(vii)	ST-can perform work by standing	Yes/No
(viii)	W-can perform work by walking	Yes/No
(ix)	SE-can perform work by seeing	Yes/No
(x)	H-can perform work by hearing/speaking	Yes/No
(xi)	RW-can perform work by reading and writing	Yes/No

Superintendent / Civil Surgeon  
Govt. Hospital (With Seal)